

06 નવેમ્બર 2018

## બ્રમ્પટન સિટિઝન્સ એવોર્ડ માટે કોઈ ઉત્કૃષ્ટ વ્યક્તિને નામાંકિત કરવા વિષયક

બ્રમ્પટન, ઓન્ટારિયો – સીટી ઓફ બ્રમ્પટને હવે બ્રમ્પટન સિટિઝન્સ એવોર્ડ માટે નામાંકનો સ્વીકારવાનો પ્રારંભ કર્યો છે. સન્માન માટે 13 જાન્યુઆરી 2019 પહેલાં 2019માં થનાર એવોર્ડ સેરિમનીમાં પુરસ્કૃત કરવા માટે ઉત્કૃષ્ટ રમતવીર, કલાકાર, સ્વયંસેવક અથવા સ્થાનિક શૂરવીરને નામાંકિત કરો.

બ્રમ્પટન સિટિઝન્સ એવોર્ડ એવા નાગરિકોનું સન્માન કરે છે જેમણે 2018ના વર્ષમાં નીચે આપેલ ક્ષેત્રોમાં કોઈ અર્થસભર ફાળો આપ્યો હોય અથવા કોઈ નોંધપાત્ર ઉપલબ્ધિ હાસલ કરી હોય:

- **સ્પોર્ટ્સ એચિવમેન્ટ એવોર્ડ** (રમતગમતમાં ઉપલબ્ધિ પુરસ્કાર) એવા બ્રમ્પટન નિવાસીઓનું સન્માન કરે છે જેમની ઉપલબ્ધિઓનું સન્માન પ્રાંતીય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે થયું હોય.
- **આર્ટ્સ અકલેઈમ એવોર્ડ** (કળા પ્રશંસા પુરસ્કાર) એવી વ્યક્તિઓને કે જૂથોનું સન્માન કરે છે જેઓના ઉત્કૃષ્ટ ફાળાથી સીટી ઓફ બ્રમ્પટન ખાતે કલાવૃદ્ધિ અને સમાજને પ્રભાવિત કર્યા હોય.
- **લોંગ ટર્મ સર્વિસ એવોર્ડ** (લાંબા ગાળાની સેવા પુરસ્કાર) એવા કટિબદ્ધ સ્વયંસેવકોને ઓળખ આપે છે જેઓએ આપણા શહેરમાં, આપેલ નોંધપાત્ર સમય અને પ્રયત્નોથી, કળા અને સામુદાયિક સામાજિક સેવાઓ વિકસીને આગળ વધી હોય.
- **ઇન્સ્પિરેશનલ એવોર્ડ** (પ્રેરણાલક્ષી પુરસ્કાર) બ્રમ્પટનના એવા નિવાસીઓનું સન્માન કરે છે જેઓ પોતાની માયાળુ કામગીરી માટેની વકાલત અને/અથવા મહાવરો કરતા હોય, અથવા જેઓએ અન્ય લોકો પર પ્રેરણાત્મક પ્રભાવ પાડ્યો હોય.
- **ઇમરજન્સી સર્વિસીસ એવોર્ડ ઓફ વેલર** (કટોકટી સેવાઓ માટે શૌર્ય પુરસ્કાર) કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ, જેમણે બીજા કોઈ વ્યક્તિનું જીવન બચાવવા પરાક્રમી કાર્ય કરીને પોતાના જીવ/જીવનને સ્વૈચ્છિકપણે જોખમમાં મૂક્યું હોય.
- **વોલન્ટીયર ઓફ ધી ઈયર એવોર્ડ** (વર્ષનો સ્વયંસેવક પુરસ્કાર) બ્રમ્પટનનાં એવા સ્વયંસેવકોનું સન્માન કરે છે જેઓએ ચોક્કસ પ્રવૃત્તિ કે ફાળાને બદલે સર્વાંગી સામુદાયિક સામેલગીરી દર્શાવી હોય. આ એવોર્ડ એવા સ્થાનિક રહેવાસીઓનું સન્માન કરે છે જેઓ સમુદાયને ઊંચું લાવતા હોય અને દર્શાવી શકતા હોય કે જુરસા અને નિર્ધારણથી શું હાંસલ કરી શકાય છે. પુરસ્કારો બે વય વર્ગોમાં ઉપલબ્ધ છે: પુખ્ત અને 18 ક્તા ઓછી વયના સ્વયંસેવકો માટે યુવા.
- **સિનિયર ઓફ ટ યર** (વર્ષના ઉત્કૃષ્ટ વરિષ્ઠ નાગરિક) પુરસ્કાર જેઓ 65 કરતા વધુ વયના હોય જેમણે વિશિષ્ટ માનવતાભર્યા પ્રયાસોથી બ્રમ્પટન ખાતે જીવન ગુણવત્તા સુધારવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હોય અથવા સમાજના વર્ધન માટે સંપૂર્ણપણે સંડોવાયા હોય તેમને સન્માનિત કરે છે.

સામાજિક મોબીઓથી બનેલ પસંદગી સમિતિ નામાંકનોની સમીક્ષા તે નિર્ધારિત કરવા માટે કરશે કે કયા નાગરિકોનું સન્માન મે 2019ની એવોર્ડ સેરિમનીમાં કરવામાં આવે. આ સમિતિમાં સમાવેશ થનાર વ્યક્તિઓને પુરસ્કારના મૂળ વિષય સાથે નજીકનો સંબંધ હશે જેમાં તેઓ

નિષ્ણાંત હશે, સાથે હશે શહેરના ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસના (Brampton Fire and Emergency Services) અધિકારીઓ, બ્રેમ્પટન સ્પોર્ટ્સ અલાયન્સ (Brampton Sports Alliance), બ્રેમ્પટન સિનિયર્સ કાઉન્સિલ (Brampton Seniors Council) અને પીલ રિજનલ પોલિસ (Peel Regional Police)ના પ્રતિનિધિઓ.

કાર્યક્રમની માહિતી માટે અથવા નામાંકન પત્રો મેળવવા માટે અહીં મુલાકાત લો [www.brampton.ca/citizensawards](http://www.brampton.ca/citizensawards)

**કવોટ:**

"બ્રેમ્પટન એક જીવંત, આવકારદાયક, ઉદાર સમાજ છે, જે આપણાં નાગરિકોના યોગદાનને આભારી છે. સિટિઝન્સ એવોર્ડ્સ એવા બાકીના કેટલાક વ્યક્તિઓને સન્માનિત કરવાની તક આપે છે જે દરરોજ આપણા શહેરને એક વધુ સારી જગ્યાએ બનાવવા માટે મદદરૂપ થાય છે.

- શહેર પરિષદ સભ્ય (સીટી કાઉન્સિલર) ગુરપ્રીત ધિલ્લોન, સિટિઝન્સ એવોર્ડ્સ કમિટીના પ્રમુખ

-30-

**બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે.** અમે તીક્ષ્ણ ફેકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

ક્રિસ્ટિન શર્મા (Christine Sharma)

મિડિયા રિલેશન્સ

સીટી ઓફ બ્રેમ્પટન

905.874.2880 | [christine.sharma@brampton.ca](mailto:christine.sharma@brampton.ca)